



# ઘરેલુ અને પારિવારિક હિંસા

## ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ અને પારિવારિક હિંસા સ્વીકાર્ય નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસા આચરવી એ કાનૂની ગુનો છે.

આવો ગુનો કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો **000** પર પોલિસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલિસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ (counselling) અને માહિતી માટે 1800 RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

## ઓસ્ટ્રેલિયાની સરકાર (Australian Government) કોઈપણ સંજોગોમાં ઘરેલુ અને પારિવારિક હિંસા ચલાવી લેતી નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસામાં જે તે સ્ત્રી કે પુરુષ સાથીને બીક બતાવીને અથવા તેમની સલામતી માટે જોખમ ઊભું કરીને તેમને કાબૂમાં રાખવાના હેતુથી કરવામાં આવતાં વર્તન કે અપાતી ધમકીઓનો સમાવેશ થાય છે. ઘરેલુ અને પારિવારિક હિંસામાં નીચેનાં કૃત્યોનો સમાવેશ થઈ શકે છે:

- મારપીટ;
- ધ્વાસ રૂંધવો;
- સ્ત્રી કે પુરુષ સાથી કે પરિવારને જરૂરિયાત મુજબનાં પૈસા ન આપવાં;
- સ્ત્રી કે પુરુષ સાથીને મિત્રો અને સગાંસંબંધીઓથી દૂર રાખવું, મળવા ન દેવું;
- સ્ત્રી કે પુરુષ સાથીનું અપમાન કરવું કે સતત ટીકા કરતા રહેવું; અને
- બાળકોને કે પાલતું પ્રાણીઓને નુકશાન પહોંચાડવાની ધમકી આપવી.

## સ્ત્રીઓને પણ પુરુષો જેવા જ હક છે.

ઓસ્ટ્રેલિયાના કાયદા સ્ત્રીઓ અને પુરુષોને સમાન રીતે લાગુ પડે છે.

દરેકને હિંસાથી મુક્ત ખુશહાલ સંબંધો અને સમાજમાં રહેવાનો હક છે.

સ્ત્રીઓએ તેમની સાથે કરવામાં આવતું ખરાબ વર્તન કે તેમને આપવામાં આવતી ઇજાઓ સહન કરવાની જરૂર નથી.



## ઓસ્ટ્રેલિયામાં જે તે સંસ્કૃતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અપાતી સેવાઓ છે જે મદદ કરી શકે છે.

**1800 RESPECT** એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

**1800 737 732** પર ફોન કરો અથવા 1800 RESPECT ની વેબસાઇટ [www.1800RESPECT.org.au](http://www.1800RESPECT.org.au) ની મુલાકાત લો.

## શું તમારે દુભાષિયાની જરૂર છે?

**131 450** પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે મફત ફોન કરો. ટીસ તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે. ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી.